

## એલિમેન્ટ્રી સ્કિપ્ટ:

તમે 'સ્કૂલ મેસેન્જર એડલ્ટ સ્કૂલ ટેલિફોન પ્રિ-રજિસ્ટ્રેશન'નો જે કોલ અંગ્રેજીમાં મેળવવાના છો તેનું આ (ગુજરાતી) ભાષાંતર છે.

આ સપ્ટેમ્બરમાં તમારા બાળકને ગ્રેડ (બાળક માટે વિશિષ્ટ)માં જવા માટે ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. (તમને તમારા દરેક બાળક માટે એક ફોન કોલ આવશે. કોલ્સ તેઓ જે ગ્રેડમાં હાજર રહેતા હશે તે દ્વારા ઓળખવામાં આવશે.)

શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે પ્રાથમિક શાળાઓ, અઠવાડિયામાં પાંચ દિવસ સંપૂર્ણ દિવસ માટે એક સમૂહવાળી અને આરોગ્ય તથા સલામતીનાં વિસ્તૃત પગલાંની ગોઠવણ સાથે પરત ખુલશે.

ટોરન્ટો પબ્લિક હેલ્થની ભલામણોના આધારે, શારીરિક અંતર રાખવા અંગે, ટીડીએસબીએ એક વ્યૂહરચના વિકસાવી છે કે જેનાથી સુનિશ્ચિત થાય કે સમગ્ર વ્યવસ્થામાં વર્ગનાં કદ શક્ય તેટલાં નાનાં થાય; જ્યારે જાહેર આરોગ્યના આંકડાઓ મુજબ જ્યાં **Covid-19**ના ફેલાવાનું જોખમ વધારે હોય તેવા સમુદાયોમાં સંસાધનોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. વધારાના સંસાધનોની જરૂર પડી શકે તેવી શાળાઓને નિર્ધારિત કરવા માટે ટોરન્ટો પબ્લિક હેલ્થ સાથે કર્મચારીગણ કામ કરી રહેલ છે.

જો તમે સપ્ટેમ્બરમાં તમારા બાળકને રૂબરૂ શિક્ષણ માટે શાળામાં ન મોકલવાનું પસંદ કરો છો, તો દૂરસ્થ શિક્ષણ -રિમોટ લર્નિંગ- માટે ટીડીએસબીની વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા તમારા બાળક માટે સંપૂર્ણ રીમોટ લર્નિંગ મોડેલ ઘરે ઉપલબ્ધ હશે. દૂરસ્થ શિક્ષણ, સેન્ટ્રલ વર્ચ્યુઅલ સ્કૂલ મોડેલ દ્વારા પહોંચાડવામાં આવશે કારણ કે દરેક શાળા આધારિત મોડેલ માટે પૂરતા પ્રમાણમાં સાધનો નથી.

તમારી શાળાએ સપ્ટેમ્બર માટે વર્ગની યાદીઓ બનાવવાની આવશ્યકતા છે, તેથી અમે તમને હાલના સમયે તમારા બાળકને રૂબરૂમાં (આનો અર્થ થાય છે કે શાળામાં રૂબરૂ) માટે અથવા રિમોટ લર્નિંગ (આનો અર્થ વર્ચ્યુઅલ સ્કૂલ) માટે નોંધાવવા જણાવીએ છીએ.

1) તમારું બાળક સપ્ટેમ્બરમાં શાળામાં કેવી રીતે પરત આવશે:

"મારું બાળક વ્યક્તિગત રૂપે રૂબરૂમાં હાજરી આપશે" માટે 1 દબાવો

"મારું બાળક રિમોટ લર્નિંગ માટે વર્ચ્યુઅલ સ્કૂલમાં ભણશે" માટે 2 દબાવો

તમારી નોંધણી બદલ આભાર. આગળનાં પગલાં વિશે અપડેટ્સ અને માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટ [www.tdsb.on.ca](http://www.tdsb.on.ca) ની મુલાકાત લો.